

February 26, 2022

BSE Limited Listing Department Phiroze Jeejeebhoy Towers Dalal Street Mumbai 400 001 National Stock Exchange of India Limited Listing Department Exchange Plaza, 5th floor Plot No. C/1, G Block Bandra-Kurla Complex Bandra (East), Mumbai 400 051

Dear Sir/Madam,

Sub.: Notice of Postal Ballot - Newspaper Publication

Pursuant to Regulation 30 and 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please note that the Notice of Postal Ballot was published on February 26, 2022 in Business Standard (all editions), Financial Express (all editions), Indian Express (Baroda edition) and Vadodara Samachar (Baroda edition). We enclose herewith the copies of the newspaper advertisements published in Business Standard (Mumbai edition) and Vadodara Samachar.

We request you to kindly take this in your record.

Thanking you,

Yours sincerely, For ICICI Bank Limited

Rinku Maniar Assistant General Manager

Encl.: As above

ICICI Bank Limited
ICICI Bank Towers
Bandra-Kurla Complex
Mumbai 400 051, India.

Tel.: (91-22) 2653 1414 Fax: (91-22) 2653 1122 Website <u>www.icicibank.com</u> CIN.: L65190GJ1994PLC021012 Regd. Office: ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road Vadodara 390007. India

Need specific incentives for 'We shouldn't restrict services sectors: Exporters

SEPC says travel, tourism and hospitality sectors need govt support

New Delhi, 23 February

he government is likely to look into the services industry's demand for sectorspecific incentives for exporters, especially the travel, tourism and hospitality sectors that have been badly hit since the outbreak of the pandemic two years ago.

Sunil H Talati, chairman, Exports Promotion Council (SEPC), told Business Standard that top officials from the department of commerce have asked the council to come up with sector-specific recommendations, as not all sectors would require support. The government also made it clear that no incentives will be given to the IT sector as its growth is already on an upswing.

"The government has asked for sector-wise suggestions (incentives), regarding why they want, how much they want and the justification. We have asked various sectors to assimilate the data and that the SEPC will submit recommendations to the government by



Monthly data ■ 2020-21 ■ 2021-22 (\$ million) ■ YoY growth (%)

153,352 180,281 10.0 7.0 19.0 9.0 19.0 20.0 20.0 18.0 35.0

SERVICES EXPORTS FROM INDIA

travel and tourism, the suggestions will include sectors such as education, legal, medical, accounting and services tax)," Talati said. and finance. The industry's demand comes in the backdrop of the government's ambitious \$1 trillion services exports target by 2030 and lack of any fiscal incentives for services exports.

"If you want to achieve that (the target) there has to be special attention given to services sector suggestions," Talati said, adding exports. If not incentive, there is a need for urgent attention to tours and travel industry as it has been

vears now. If nothing else, give us a rebate in credit for GST (goods

Last year, the SEPC had urged the government to rollout a new scheme - Duty Remission of Export of Services Scheme - to reimburse un-refunded taxes and duties embedded in services exports. The government, however, did not go ahead with the proposal.

Service Exports from India Scheme (SEIS) is the only central incentive scheme that has been rolled out in six years. However,

the end of the month. Apart from affected by the pandemic for two the outlay for it was drastically cut over the years and, according to Talati, the government has also made it clear that the scheme will be discontinued.

> The services sector is a key driver of India's economic growth, provides employment to nearly 26 million people and contributes approximately 40 per cent to India's total exports.

Services exports have totalled \$180.28 billion during the first three quarters of the current fiscal, up 17 per cent year on year. The target for FY22 is \$250 billion.

Gencos to be penalised for low coal stock

Ministry notifies new coal stocking norms; gencos to abide by month-wise threshold

SHREYA IAI New Delhi, 24 Feb

Thermal power generating companies (gencos) that do not maintain adequate coal stock will face penalty, which includes reduction in

levy from power distribution companies (discoms). The Union Ministry of Power notified new coal

gencos to maintain ade-

the Bank from Related Party.

any crisis during lean coal supply months.

The penalty will be computed based on the shortfall — wherein the fixed charge of shortfall in normative fixed charge of the tariff they availability of coal.

The ministry in its has tabulated month-wise stock to be maintained by pithead stocking norms that require (near coal mines) and non-formance and status of pay-

quate stock of coal to avoid plans. For pithead, the stock ranges from 12-17 days and for non-pithead 20-26 days.

The power plants have been instructed to maintain adequate stock during the will be reduced to the extent fourth quarter to balance their coal need during the monsoon months, when coal supply dips.

The notice also said gencos will be graded on a monthly basis on their perpithead (away from mines) ment to the coal companies.

Gencos to be fined for selling in open market without consent

The Union Ministry of Power in a gazette notification said gencos will be penalised if they sell contracted power in the open market without the consent of the buyer. "In case the seller fails to offer the contracted power as per the agreement to the procurer and sells this power without procurer's consent to any other party, the procurer shall be entitled to claim damages from the seller for an amount equal to the higher of twice the tariff as per the PPA," said the notification.

our ability to respond'

JAYANTH R VARMA, the external member of the Reserve Bank of India's Monetary Policy Committee (MPC), says he doesn't think monetary policy is ineffective when inflation is driven by supply-side forces. Varma, the only dissenting member of the MPC, tells Manojit Saha why he has not voted for maintaining the RBI's accommodative stance in the last four policies. Edited excerpts:

With growth yet to revive on a durable basis and inflation expected to come down sharply from the current level, what is the main reason for your voting against the accommodative

There is a very high degree of uncertainty on both inflation and growth and I see the risks as being balanced on both sides. In such a situation, it is imperative that the policy stance should be neutral. I am not objecting to keeping rates low today, but I do think it is imprudent to commit to keeping rates low in future as well. We should not tie our hands behind our back and restrict our ability to respond to the growth and inflation shocks that may arise.

Can you throw some light on why you said 'the continued harping on combating the ill effect of the pandemic has become counterproductive'?

With the pandemic behind us, monetary policy has to go back to dealing with the slowdown of the busi-

ness cycle

that began

in 2019 (if

not earli-

critical

issue

under-

standing

where we

The



External member of

are on this cycle. Are we on the cusp of a cyclical growth recovery or are we going to remain in the trough for an extended period? Similarly, is inflation a transient phenomenon or is it longer lasting? This requires deep analytical thinking, but the continued focus on the pandemic deflects attention away from these difficult questions, and encourages a status quo bias.

In the minutes, you said 'fan charts also reveal a very large range of uncertainty on both inflation and growth'. What is vour view on the fact that all the



THE UKRAINE SITUATION IS A SHOCK **BOTH TO GROWTH** AND TO INFLATION. AND IT IS TOO EARLY TO SAY WHICH OF THESE TWO SHOCKS WILL BE BIGGER



MPC members unanimously accept RBI's inflation projection?

For me (and I speak only for myself here), the main takeaway from the fan chart is not the point forecast of 4.2 per cent or 4.5 per cent, but the huge width of the fan chart. The uncertainty is so large that point

With the pandemic

monetary policy has

behind us,

to go back to

dealing with the

slowdown of the

critical issue is

understanding

this cycle

where we are on

business cycle that

began in 2019. The

forecasts are not very meaningful. The difference between the RBI forecasts and the more hawkish forecasts that I have seen from analysts is much less significant than one may think, because the confidence bands of these apparently divergent forecasts overlap quite a lot. In particular, the risk of inflation going beyond

even the upper tolerance band is non-trivial even under the RBI fore-

Do you think monetary policy is completely ineffective if the sources of inflation are from the supply side?

Not at all. Supply shocks should lead to shifts in relative prices, and the job of monetary policy is to prevent these from affecting the gen-

eral price level. Currently, supply shocks are affecting goods more than services. Changes in relative prices that make services cheaper help shift demand away from scarce goods to abundant services, and thereby rebalance the economy. There is no reason at all why this

should cause a change in inflation.

What is the range of positive real interest rates you will be comfortable

That depends on the growth and inflation outcomes, and I am unwilling to quantify that more precisely at this stage.

Geopolitical tensions have deepened with Russia invading Ukraine. Does it change your views?

My statement began by noting that geopolitical tensions are now more important than the pandemic, and so these developments do not necessitate any change in my views. The Ukraine situation is a shock both to growth and to inflation, and it is too early to say which of these two shocks will be bigger.



CIN-L65190GJ1994PLC021012

Registered Office: ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodara 390 007, Gujarat, Phone: 0265-6722286 Corporate Office: ICICI Bank Towers, Bandra-Kurla Complex, Mumbai 400 051, Maharashtra, Phone: 022-26538900, Fax: 022-26531230 Website: www.icicibank.com. Email: investor@icicibank.com

NOTICE OF POSTAL BALLOT

Members of the ICICI Bank Limited ("Bank"/"Company") are hereby informed that pursuant to the provisions of Section 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 including any statutory modification or re-enactment thereof for the time being in force ("Act"), read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 ncluding any statutory modification or re-enactment thereof for the time being in force ("Rules"), read with General Circula No.14/2020 dated April 8, 2020, General Circular No.17/2020 dated April 13, 2020 and other relevant circulars, including General Circular No.20/2021 dated December 8, 2021, issued by the Ministry of Corporate Affairs, Government of India ("MCA Circulars"), the following resolutions are proposed to be passed by the Members through Postal Ballot only through the remote e-voting

- 1. Special Resolution for Appointment of Ms. Vibha Paul Rishi (DIN: 05180796) as an Independent Director.
- 2. Ordinary Resolution for Material Related Party Transactions for current account deposits.
- 3. Ordinary Resolution for Material Related Party Transactions for subscribing to securities issued by Related Parties and purchase of securities from Related Parties.
- 4. Ordinary Resolution for Material Related Party Transactions for sale of securities to Related Parties.
- 5. Ordinary Resolution for Material Related Party Transactions for fund based or non-fund based credit facilities.
- 6. Ordinary Resolution for Material Related Party Transactions for undertaking repurchase (repo) transactions and other permitted short-term borrowing transactions.
- 7. Ordinary Resolution for Material Related Party Transactions of reverse repurchase (reverse repo) and other permitted shortterm lending transactions 8. Ordinary Resolution for Material Related Party Transactions for availing manpower services for certain functions/activities of

Members are informed that the Bank has on February 24, 2022, sent the Postal Ballot Notice dated February 18, 2022 through electronic mode to the Members of the Bank whose names appear in the Register of Members/List of Beneficial Owners as received from Depositories i.e. National Securities Depository Limited ("NSDL") and Central Depository Services (India) Limited ("CDSL") as on Friday, February 18, 2022 and who have their e-mail addresses registered with the Bank/Depositories, for seeking approval by Postal Ballot only through remote e-voting. A person who is not a Member as on Friday, February 18, 2022, should treat the Postal Ballot Notice for information purposes only.

The Postal Ballot Notice is also available on the website of the Bank at https://www.icicibank.com/aboutus/notice.page?#toptitle, website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and the website of NSDL at www.evoting.nsdl.com. Members holding shares in dematerialised mode are requested to register/update their KYC details including email address with the relevant Depository Participants. Members holding shares in physical mode are requested to register/update their KYC details including email address by submitting duly filled and signed Form ISR-1 at investor@icicibank.com along with the copy of the share certificate (front and back), self-attested copy of the PAN card and such other documents as prescribed in the Form.

Members of the Bank whose names appear in the Register of Members/List of Beneficial Owners as received from Depositories i.e., NSDL/CDSL as on Friday, February 18, 2022, shall be entitled to vote in relation to the resolutions specified in the Postal Ballot Notice. The Bank has appointed NSDL for facilitating remote e-voting to enable the Members to cast their votes electronically. Members including those who are holding shares in physical form or who have not registered their email addresses, can cast their votes by following the instructions mentioned in the Postal Ballot Notice dated February 18, 2022.

Form ISR-1 is available on the website of the Bank at https://www.icicibank.com/aboutus/invest-relations.page?ITM=nli cms

The remote e-voting period commences on Saturday, February 26, 2022 at 9:00 a.m. IST and ends on Sunday, March 27, 2022 at 5:00 p.m. IST. The remote e-voting shall not be allowed beyond the said date and time. The remote e-voting module shall be disabled for voting thereafter. Once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it

The voting rights of the Members shall be in proportion to their shares in the total paid-up equity share capital of the Bank, as on Friday, February 18, 2022, subject to the provisions of the Banking Regulation Act, 1949, as amended.

In case of any queries or issues or grievances pertaining to e-voting, Members may refer to Help/FAQ's section available at www.evotina.nsdl.com or call on toll free no.: 1800-1020-990/1800-224-430 or send a request at evoting@nsdl.co.in or contact Ms. Pallavi Mhatre, Manager, National Securities Depository Limited, Trade World, 'A' Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai 400 013, at pallavid@nsdl.co.in or at telephone no.: +91-22-2499 4545. Alternatively, Members may also write to the Company Secretary of the Bank at investor@icicibank.com or contact at telephone no.: +91-22-

The results of Postal Ballot shall be declared on or before Tuesday, March 29, 2022, at any time before 6:00 p.m. IST and along with the Scrutinizer's report, be displayed at the Registered as well as Corporate Office of the Bank, communicated to the Stock Exchanges and will also be uploaded on the Bank's website at www.icicibank.com and on the website of NSDL at www.evotina.nsdl.com.

For and on behalf of the Board of Directors

Ranganath Athreya **Company Secretary**

wizard

ward WARDWIZARD INNOVATIONS AND MOBILITY LIMITED

(Formerly known as Manvijay Development Company Limited)

Corporate Identification Number: L35100MH1982PLC264042

Our Company was originally incorporated as 'Manvijay Development Company Limited in the State of West Bengal as a public limited company, under the Companies Act, 1956 and a Certificate of Incorporation dated October 20, 1982, was issued by the Registrar of Companies, West Bengal-Calcutta. Thereafter our Company obtained a Certificate of Commencement of Business on November 23, 1982. The Registered office of our Company was shifted from State of West Bengal to the State of Maharashtra pursuant to the provisions of the Companies Act, 2013 on May 19, 2015. Subsequently, the name of our Company was changed to its present name on February 05, 2020, and a fresh Certificate of Incorporation was issued by the Registrar of Companies, Maharashtra, Mumbai.

Registered Office: No. 401, Floor-4, 23/25, Dhun Building Janmabhoomi, Marg, Horniman Circle, Fort, Mumbai - 400001, Maharashtra **Tel:** +91 022 -22024366; **Fax:** N.A.

Corporate Office Address: Survey 26/2, Opposite Pooja Farm, Sayajipura, Ajwa Road, Vadodara, Gujarat - 390019; Tel No: + 91 9727755083. E-mail: compliance@wardwizard.in; Website: www.wardwizard.in. Contact Person: Ms. Jaya Ashok Bhardwaj, Company Secretary and Compliance Officer

OUR PROMOTERS: MR YATIN GUPTE, WARDWIZARD SOLUTIONS INDIA PRIVATE LIMITED, **AEVAS BUSINESS SOLUTIONS PRIVATE LIMITED AND GARUDA MART INDIA PRIVATE LIMITED**

ISSUE OF UPTO 59,62,373 PARTLY PAID-UP EQUITY SHARES OF FACE VALUE OF ₹1 EACH ("RIGHTS EQUITY SHARES") OF OUR COMPANY FOR CASH AT A PRICE OF 82 EACH INCLUDING A SHARE PREMIUM OF ₹81 PER RIGHTS EQUITY SHARE (THE "ISSUE PRICE"). AGGREGATING TO RS.4889.15* LACS ON A RIGHTS BASIS TO THE EXISTING EQUITY SHAREHOLDERS OF OUR COMPANY IN THE RATIO OF ONE(1) RIGHTS EQUITY SHARE FOR EVERY FORTY THREE (43) FULLY PAID-UP EQUITY SHARE(S) HELD BY THE EXISTING EQUITY SHAREHOLDERS ON THE RECORD DATE, THAT IS ON JANUARY 22, 2022 (THE "ISSUE"). THE ISSUE PRICE FOR THE RIGHTS EQUITY SHARES IS ₹ 82 WHICH IS 82 TIMES THE FACE VALUE OF THE EQUITY SHARES. FOR FURTHER DETAILS, PLEASE REFER TO "TERMS OF THE ISSUE" * Assumina full subscription

NOTICE TO ELIGIBLE EQUITY SHAREHOLDERS OF THE COMPANY

RIGHTS ISSUE OPENED

Last date for receipt of Rights Issue Application forms is extended upto Tuesday, March 8, 2022

"We have requested stock exchange to re-open the trading window of right entitlement through on-market renunciation."

Simple, Safe, Smart way of Application – Make use of it!!! PROCEDURE FOR APPLICATION: In accordance with Regulation 76 of the SEBI ICDR Regulations, SEBI Rights Issue Circulars and ASBA Circulars, all investors desiring to

Applications Supported by Blocked Amount (ASBA) is a better way of applying to issues by simply blocking the fund in the bank account. For details, check section on ASBA below

Kindly note that Non-Resident Investors cannot apply in this Issue using the R-WAP facility, and therefore will have to apply through ASBA mode. Investors should carefully read the provisions applicable to such applications before making their application through ASBA or the optional mechanism. For details of

procedure for application by the resident eligible shareholders holding equity shares in physical form as on record date, please see "Procedure for application by eligible equity shareholders holding equity shares in physical form" on page 218 of the Letter of Offer PLEASE NOTE THAT ONLY RESIDENT INVESTORS CAN SUBMIT THEIR APPLICATION USING THE R-WAP R-WAP FACILITY IS OPERATIONAL FROM THE ISSUE **OPENING DATE**

make an application in this issue are mandatorily required to use the ASBA process or the optional mechanism instituted only for Resident Individual Investors in this Issue.

LAST DATE FOR APPLICATION: This is to inform the Eligible shareholders of the Company that the date of Closure of the Rights issue which was opened on Monday, February 07, 2022 and scheduled to be closed on Monday, February 28, 2022 has now further extended by the Company from Monday, February 28, 2022 to Tuesday, March 08, 2022 vide board meeting dated February 25, 2022, in order to provide opportunity to shareholders to exercise the rights in the Rights Issue. Accordingly, Last date of submission of the duly filled Rights Issue Application forms is extended upto Tuesday, March 08, 2022 (i.e. Issue Closing Date)

PLEASE NOTE THAT THE ELIGIBLE EQUITY SHAREHOLDERS WHO HOLD EQUITY SHARES IN PHYSICAL FORM AS ON RECORD DATE AND WHO HAVE NOT FURNISHED THE DETAILS OF THEIR RESPECTIVE DEMAT ACCOUNTS TO THE REGISTRAR OF OUR COMPANY ATLEAST TWO WORKING DAYS PRIOR TO THE ISSUE CLOSING DATE i.e. MARCH 04, 2022, SHALL NOT BE ELIGIBLE TO MAKE AN APPLICATION FOR RIGHTS EQUITY SHARES AGAINST THEIR RIGHTS ENTITLEMENTS WITH RESPECT TO THE EQUITY SHARES HELD IN PHYSICAL FORM.

Allotment of rights equity shares in dematerialised form: Please note that the rights equity shares applied for in this issue can be allotted only in dematerialised form and to the same depository account in which our equity shares are held by such investor on the record date.

If the Application Form is not submitted with a SCSB nor uploaded with the Stock Exchange and the Application Money is not blocked with the SCSB or if the Application Form is not accepted at the R-WAP, on or before the Issue Closing Date i.e. March 08, 2022 or such date as may be extended by our Board or any committee thereof, the invitation to offer contained in the Letter of Offer shall be deemed to have been declined and our Board or any common to offer shall be deemed to have been declined and our Board or any common to offer shall be deemed to have been declined and our Board or any common to offer shall be deemed to have been declined and our Board or any common to offer shall be deemed to have been declined and our Board or any common to offer shall be deemed to have been declined and our Board or any common to offer shall be deemed to have been declined and our Board or any common to offer shall be deemed to have been declined and our Board or any common to offer shall be deemed to have been declined and our Board or any common to offer shall be deemed to have been declined and our Board or any common to offer shall be deemed to have been declined and our Board or any common to offer shall be deemed to have been declined and our Board or any common to offer shall be deemed to have been declined and our Board or any common to offer shall be deemed to be deemed to be declined and our Board or any common to offer shall be deemed to be dee hereby offered, as provided under the section, "Basis of Allotment" on page 229 of the Letter Of Offer

ELIGIBLE EQUITY SHAREHOLDERS OF THE COMPANY WHO ARE ENTITLED TO APPLY FOR THE RIGHTS ISSUE ARE REQUESTED TO TAKE NOTE OF THE ISSUE CLOSURE DATE AS MARCH 08, 2022. ACCORDINGLY, THERE IS NO CHANGE IN THE LETTER OF OFFER, ABRIDGED LETTER OF OFFER, STATUTORY ADVERTISEMENT, ENTITLEMENT LETTER AND APPLICATION FORM EXCEPT OF MODIFICATION IN THE ISSUE CLOSING DATE: RESULTANT CHANGE IN THE INDICATIVE TIMELINE OF POST ISSUE ACTIVITIES ON ACCOUNT OF EXTENSION OF ISSUE CLOSING DATE



Date: February 25, 2022

Place: Vadodara

LEAD MANAGER TO THE ISSUE FEDEX SECURITIES PRIVATE LIMITED (Formerly known as Fedex Securities Limited) CIN: U67120MH1996PTC102140 B7, Jay Chambers, Dayaldas Road, Vile Parle East,

Tel. No.: +91 22 26186966; E-Mail: mb@fedsec.in Contact Person: Yash Kadakia Website: www.fedsec.ir SEBI Reg. No.: INM000010163



REGISTRAR TO THE ISSUE

PURVA SHAREGISTRY (INDIA) PVT. LTD. Unit No. 9, Ground Floor, Shiv Shakti Industrial Estate, J. R. Boricha Marg, Lower Parel East, Mumbai – 400011, Maharashtra, Contact Details: +91-22-2301 6761/8261 Email Address: support@purvashare.com; Website: www.purvashare.com; Contact Person: Ms. Deepali Dhuri

SEBI Registration Number: INR000001112 For Wardwizard Innovations and Mobility Limited On behalf of Board of Directors

Company Secretary and Compliance Officer

Place: Mumbai Date: February 25, 2022 Sd/-

અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી

ગુજરાતમાં જુની પેન્શન ચોજના લાગુ કરી ન્યાય આપવા માટે કરી માંગણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રી ભૃપેન્દ્ર પટેલને પત્ર લખીને રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ જુની પેન્શન યોજના લાગુ કરી કર્મચારીઓને ન્યાય આપવા માટે માંગણી કરી છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં મોઢવાડિયાએ જણાવ્યું છે કે સરકારી કર્મચારીઓના હિત અને માંગણીને ધ્યાનમાં રાખીને રાજસ્થાનની અશોક ગહેલોતની આગેવાની વાળી કોંગ્રેસ સરકારે ૧ જાન્યૂઆરી, ૨૦૦૪ પહેલાની જૂની પેન્શન યોજના લાગ્ કરીને રાજ્યના સરકારી કર્મચારીઓના ભવિષ્યને પેન્શનથી સુરક્ષીત કરવાનો પ્રશંસનીય નિર્ણય લીધો છે.ગુજરાતમાં સરકારી યોજનાઓના પ્રમોશન અને સરકારી કાર્યક્રમોના આયોજન કરીને આ કાર્યક્રમના રાજકીય લાભ મેળવવા પાછળ બેફામ ખર્ચ થાય છે. પરંતુ જે કર્મચારીઓ સરકાર અને સરકારી વહિવટ ચલાવે છે તેમને નિવૃત્તિ બાદ આર્થિક આત્મનિર્ભરતાનો હક આપવામાં ઉણી ઉતરી રહી છે. એટલે રાજસ્થાન સરકારના નિર્ણયમાંથી પ્રેરણા લઈને ગુજ<u>રાત સરકારે પણ</u>

આ૫૫ા રાજ્યના સરકારી કર્મચારીઓની માંગણી અને હિતને ધ્યાનમાં રાખી જાન્યૂઆરી, 5 0 0 8 પહેલાની જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે સકારાત્મક

મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે, સરકારી કર્મચારીઓ પોતાના જીવનના ૩૦થી ૪૦ વર્ષ જેટલો કિમતી સમય પોતાની ફરજમાં આપે છે. તેમને બાદ આર્થિક નિવૃત્તિ આત્મનિર્ભરતાનો હક છે. ૧ જાન્યુઆરી, ૨૦૦૪ પહેલા જેઓ સરકારી નોકરીમાં જોડાયા હતા તેવા કર્મચારીઓને નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા મળી રહે તે માટે પેન્શન ચુકવવામાં આવતું હતું. આ પેન્શન તેમની સેવા પર આધારિત ન હતું પરંતુ નિવૃત્તિ સમયે કર્મચારીના પગાર પર આધારિત હતું. આ યોજના હેઠળ નિવૃત કર્મચારીના મૃત્યુ બાદ તેમના પરિવારના સભ્યોને પણ પેન્શનની સવિધાનો લાભ મળવાપાત્ર હતો. જેની મદદથી સરકારી કર્મચારી નિવૃત્તિ બાદ પોતાના પરિવાર સાથે માનભેર જીવન નિર્વાહ કરવા માટે સક્ષમ હતા.

નવી પેન્શન યોજનાની ખામીઓ અંગે તેમણે જણાવ્યું હતું કે ૧ જાન્યુઆરી, ૨૦૦૪થી લાગુ કરવામાં નિ ર્ણ ય આવેલ નવી પેન્શન યોજનામાં લેવાય તે કર્મચારીના બેઝીક પગાર અને ઇચ્છનીય મોંઘવારી ભથ્થાની ૧૦% રકમ

પશ્ચિમ રેલ્વે

ઇ-પ્રોક્યોરમેન્ટ ટેન્ડર નોટિસ નંબર એસ/૦૫/૨૦૨૨ તારીખ ૨૪ ૦૨ ૨૦૨૨

મુધારો : ૧) નિયત તારીખ ૨૪.૦૨.૨૦૨૨ થી ૦૩.૦૩.૨૦૨૨ સુધી મુલતવી રાખવામાં આવી છે અને કૃપા કરીને ટેન્ડ

ર્નોટિસ નંબર એસ/૦૩/૨૦૨૨ ના ક્રમ નં. ૪૩ પર ૧૮૪૨૮૯ એમટીઆર ને બદલે ૧૮૪૮૨૯ એમટીઆર વાંચો

સુધારો : (૨) કૃપા કરીને ટેન્ડર સુચના નંબર એસ/૦૪/૨૦૨૨ તા. ૧૭.૦૨.૨૦૨૨(સીલબંધ જાળવણી મુકત વીઆરએલર

એટરી રવી/300એએચ) વિગતવાર સૂચના અંગે ઇએમડી, ખરીદી પ્રતિબંધો અને વિગતવાર ટેન્ડર શસ્તો કૃપા કરીને વેબસાઇટ www.ireps.gov.in અ

અનુનં આઇટમનું ટૂંકું વર્ણન

૭૬ એર બ્રેક હોસ કપ્લીંગ

૮૩ પાવર કેબલ ૨ x ૨૫ SQ MM
૮૪ ઇલેક્ટ્રો મેગ્નેટિક કોન્ટ્રાક્ટર

www.wr.indianrailways.gov.in ની મુલાકાત લો.

૭૮ ટોપ સાઇડ બેરર લાઇનર ૭૯ પાતળી દિવાલવાળી બીમ ૧ કોર x ૧૦ SQ MM ૮૦ સ્ટેટિક કન્વર્ટર માટે રિલે

૦૨.૦૨.૨૦૨૨ (કોપર કેટેનરી વાયર (૧૯/૨.૧૦એમએમ) ૬૫ ચો.મી.)

આધારિત ફંડમાં રોકાણ કરવામાં આવે છે. કર્મચારીની નિવૃતિ બાદ તમામ રકમ તથા રકમ પર મળતું રિટર્ન ઉમેરી કર્મચારીઓને પેન્શન અપાય છે. આ કંડ સરકાર જુદી જુદી સ્કીમમા રોકાણ કરે છે. જે માર્કેટ પર નિર્ભર છે. જેનું કોઈ ભવિષ્ય નથી. ઘણીવાર બજારમા ઉથલપાથલ થાય તો કર્મચારીઓ ના રોકાયેલ નાણા ધોવાય જાય છે. જે ખુબજ ગંભીર બાબત છે.આ નવી પેન્શન યોજનામાં નિવૃત્તિ સમયે નજીવ્ પેન્શન પ્રાપ્ત થાય છે જેનાથી જીવન ગુજારો કરવો અઘરો છે. જે સરકારી કર્મચારી પોતાના જીવનના ૩૦થી ૪૦ વર્ષ પોતાની સેવા બજાવે તેને છેલે જીવન નિર્વાહ માટે પેન્શનના મળે તો તે હળાહળ અન્યાય છે. જેથી સરકારી કર્મચારીઓના હિતમાં આપ પણ રાજસ્થાન સરકારની જેમ જૂની પેન્શન યોજનાફરી

સબંધીત હકારાત્મક

દેવવ્રતે મહર્ષિ દયાનંદ વિશ્વવિદ્યાલય રાજ્યપાલે જણાવ્યું હતું કે સમાજમાં વ્યાપ્ત કૃરિવાજો, અંધશ્રધ્ધા રોહતક દ્વારા યોજાયેલી ભારતીય જ્ઞાન પરંપરાના પુનરૂત્થાનમાં મહર્ષિ દયાનંદનું અને ધર્મના નામે ચાલતા પાખંડ સામે યોગદાન વિષયક આંતરરાષ્ટ્રીય મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ સંગોષ્ઠીમાં સહભાગી થતા જણાવ્યુ પ્રકાશ જેવા ગ્રંથો વડે વૈદિક સત્યના હતુ કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીએ મૂળ સ્વરૂપને ઉજાગર કરી સમાજમાં ભારતીય વૈદિક જ્ઞાન પરંપરાના નૃતન ચેતનાનો સંચાર કર્યો હતો તેમણે પુનરૂત્થાન દ્વારા વેદનાં સત્યને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યુ હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતુ કે,

(પ્રતિનિધિ)અમદાવાદ,તા.૨૫

ગજરાતના રાજ્યપાલ આચાર્ય

સ્વદેશ, સ્વભાષા, સંસ્કૃતિરક્ષા અને રાષ્ટ્રીય એકતા માટે સમાજને જાગૃત અંગ્રેજોની ગુલામીથી ત્રસૃત ભારતીય આ પ્રસંગે મહર્ષિ દયાનંદ સમાજમાં મહર્ષિ દયાનંદે રાષ્ટ્ર ચેતનાને યુનિવર્સિટી રોહતકના કુલપતિ પ્રો. જાગૃત કરવાનું જે કાર્ય કર્યુ તેના રાજવીરસિંહ તેમજ ગુરૂકળ કાંગડી પરિણામે શહિદ ભગતસિંહ, શ્યામજી વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો.રૂપકિશોર શાસ્ત્રી તેમજ મહર્ષિ કૃષ્ણ વર્મા, રામપ્રસાદ બિસ્મીલ અને

જગદીશભાઇ રાઠોડીયાના દીકરી ગુમ થયા

સાવલી તાલુકાના રાઠોડવાસ ઇંદ્રાડના રહીશ જગદીશભાઇ ફ્તેસિંગ રાઠોડીયાના ૧૫ વર્ષીય દીકરીનું લગ્નના ઇરાદે અપહરણ થયું છે. રાઠોડવાસ ઇંદ્રાડના રહીશ વિનોદભાઇ હરમનભાઇ

લાલા લજપતરાય જેવા સ્વતંત્રતા

રાઠોડીયા તેને તા.૯ ફેબ્રુઆરીના રોજ સવારે ૫ વાગ્યે પટાવી ફોસલાવી ભગાડી ગયો છે. ગુમ થનાર ઘંઉવર્ણી, આશરે ૫ ક્ટ ૨ ઇંચ ઉંચાઇ, મધ્યમ બાંધો, કાળા વાળ અને કાળી આંખો ધરાવે છે.

દયાનંદ શોધપીઠ રોહતકના ર્ડા.

સેનાનીઓને દેશની આઝાદી માટે

સમર્પિત થવાની પ્રેરણા મળી હતી.

જીંદાલ હોટેલ્સ લિમિટેક

CIN: L18119GJ1984PLC006922 રજી. ઓફિસ : ગ્રાન્ડ મરકયોર વડોદરા સુર્યા પેલેસ, સયાજીગંજ, વડોદરા-૩૯૦૦૨૦. **GRAND MERCURE**

ફોન: ૦૨૬૫-૨૩૬૩૩૬૬ / ૨૨૨૬૦૦૦ / ૨૨૨૬૨૨૬. ઈ-મેઈલ: share@suryapalace.com નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ ની પહેલી અસાધારણ સામાન્ય સભાની નોટીસનો સુધારપત્રક nણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ની પહેલી અસાધારણ સામાન્ય સભાની નોટીસની માહીતી તારીખ ૨૪ મી ફેબ્રુઆરી ૨૦૨૨ ના

રોજ વડોદરા સમાચારમાં પ્રકાશીત થયેલા પ્રકાશનના સંદર્ભમાં અમે પૃષ્ઠ નંબર ૨૧ પરના સુધારા તરફ તમારૂં ધ્યાન દોરવા માંગીએ છીએ. નીચે પ્રમાણેનો વિગતવાર સુધારો નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ ની પહેલી અસાધારણ સામાન્ય સભાની નોટીસના સુધારપત્રક તરીકે ગણવામાં આવશે.

નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ ની પહેલી અસાધારણ સામાન્ય સભાની નોટીસનો સુધારપત્રક :

ઝનુ. નં.	વ્યંબ 5 તૃહ	વિગત	મુળ વાક્ય	સુધારેલ વાક્ય
9	૨૧	કંપની અધિનીયમ, ૨૦૧૩ ની કલમ ૧૦૨(૧) ના અનુસંધાને ખુલાસાત્મક નિવેદન કે જે નોટીસનો (માગ છે: પોઇન્ટ નં. ૧૫ (i)અન્થ જાહેરાતો / ઉપક્રમો.	i. આથી તે પુષ્ટિ કરવામાં આવે છે કે કંપની કે તેના ડિરેક્ટરો અને કંપનીના જાણકાર અનુસાર તેના પ્રમોટર્સ કે પ્રપોઝડ અલોટીસ્ ઇરાદાપૂર્વક ડીફોલ્ટર નથી.	i. આથી તે પુષ્ટિ કરવામાં આવે છે કે કંપની કે તેના ડિરેક્ટરો અને કંપનીના જાણકાર અનુસાર તેના પ્રમોટર્સ કે પ્રપોઝડ અલોટીસ્ ઇરાદાપૂર્વક ડીફોલ્ટર અથવા તો છેતરપિંડી પૂર્વક નાણાં ઉછીના લેનાર નથી.
	2 > 0		0) 0	0

કંપનીએ ઉપર મુજબ સુધારેલ ઇ.ઓ.જી.એમ. ની નોટીસ શુક્રવાર, તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ ઇ-મેઇલ દ્વારા એવાજ સભ્યોને ઇલેક્ટ્રોનીકલી મોકલાવી આપવામાં આવેલ છે કે જેઓના ઇ-મેઇલ આઇડી કંપનીના રજીસ્ટ્રાર, ડીપોઝીટરીસ / ડીપોઝીટરી પાર્ટીસીપન્ટ (ડી.પી.) પાસે નોંધાવેલ છે.

સ્થળ : વકો દરા તારીખ: ૨૫ફેબ્રુઆરી, ૨૦૨૨

જીંદાલ હોટલ્સ લિમિટેક વતી

the Bank from Related Party.

મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી, રોહતક દ્વારા યોજાયેલી આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીમાં સહભાગી થતા રાજયપાલ આચાર્ચ દેવવ્રત રવિપ્રકાશે પણ મહર્ષિ દયાનંદ સરસ્વતીના યોગદાન સંદર્ભે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

વડોદરા મહાનગરપાલિકા www.vmc.gov.in

આકારણી શાખા બાકી કરદાતાઓના લાભાર્થે વ્યાજ વળતર યોજના

ડોદરા મહાનગરપાલિકાની હૃદમાં આવેલી મિલક્તોના બાકી વેરા વસુલાત માટે વ્યાજ વળતર યોજના અમલમાં મુકવા માટે કરાવ અંક– ૩૮ /તા.૧૯–૦૨–૨૦૨૨ થી સમગ્ર સભાની મંજૂરી મળેલી છે. જે અનુસાર નીચે મુજબની યોજના અમલમાં મુકવામાં આવેલી છે.

"ભાડા આકારણી પધ્ધતિ માટે ઇન્સેન્ટીવ રીબેટ યોજના'

- **૧) વડોદરા મહાનગરપાલિકાનો તા. ૧–૪–૨૦૦૩ સુધીનો ભાડા આકારણીનો ભરવાપાત્ર મિલકત કર (સામાન્ય કર, પાણી** ચાર્જ/ ર, કન્ઝરવન્સી ચાર્જ, જાજરૂ વેરો, શિક્ષણ ઉપકર અને દંડની રકમ) એક સહ ભરે તો નીચે મુજબ ઇન્સેન્ટીવ રિબેટ યોજનાનો લાભ
- ક) નોટીસ ફ્રી, વોરંટ ફ્રી, અને જાહેરાત ખર્ચની ૧૦૦% ની રકમ ઇન્સેન્ટીવ રિબેટ તરીકે આપવામાં આવશે.
- ખ) (૧) (i) ભાડા આકારણી પધ્ધતિના બાકી મિલકત વેરા પેટેની ત્યાજની રકમમાં ૮૦% રકમ ઇન્સેન્ટીવ રિબેટ તર્રીકે આપવામાં
 - (ii) ભાડા આકારણી પધ્ધતિના વેરા બીલમાં હકત ત્યાજની રકમ બાકી હોય તો સદર ત્યાજની રકમમાં પણ ૮૦% રકમ ઇन्सेन्टीव रिजेट तरीड आपवामां आवशे.
- (૨) ભાડા આકારણી પધ્ધતિની દેક્ષ અપીલ, તેમજ રીટર્ન થયેલા ચેકની ડિમાન્ડ ચઢાવેલી હશે તો તેઓને પણ વ્યાજની ચક્મમાં સદર ઇન્સેન્ટીવ રીબેટ યોજનાનો લાભ આપવામાં આવશે. પરંતુ તેવા કિસ્સામાં રીટર્ન થયેલા ચેક અંગે નિયમથી વસુલ કરવાપાત્ર ચાર્જ ઇલાયદા વસુલ કરવાનો રહેશે.
- (3) ડોઇપણ કરદાતા ફક્ત ભાડા આકારણી પધ્ધતિની પાછલી બાકી રકમ ભરપાઇ કરે તો તેને પણ સદર યોજનાનો લાભ

સને ૨૦૦૩–૦૪ થી સને ૨૦૨૧–૨૨ સુધી વેરો બાકી હોય તેવા ગરીબ અને મધ્યમ વર્ગના કરદાતાઓને ઇન્સેન્ટીવ રીબેટ યોજના

- "ક્ષેત્રફળ આધારિત આકારણી પધ્ધતિ માટે ઇન્સેન્ટીવ રીબેટ યોજના"
- ૧) સને ૨૦૦૩-૦૪ થી સને ૨૦૧૯-૨૦ સુધીની બાડી ૨૬મ ઉપર નીચે મુજબની ઇન્સેન્ટીવ રિબેટ સ્ક્રીમ મુજબ લાભ આપવામાં
- (ક) નોટીસ ફી. વોરંટ ફી. અને જોદરાત ખર્ચની રકમમાં ૧૦૦% રકમ ઇન્સેન્ટીવ રિબેટ તરીકે આપવામાં આવશે.
- (ખ) (૧) તમામ રહેણાંક મિલ્કતોની બાકી પર ચઢેલ ત્યાજની રકમમાં ૮૦% રકમ ઇન્સેન્ટીવ રિબેટ તરીકે આપવામાં આવશે. (૨) તમામ બિન રહેણાંકની મિલ્કતો માટે બાકી પર ચહેલ વ્યાજની રકમમાં ૫૦% રકમ ઇન્સેન્ટીવ રિબેટ તર્રીકે આપવામાં
- ૨) (૧) કોરોનાકાળ દરમ્યાન ચાલુ વર્ષના(૨૦૨૧–૨૨) તથા પાછલા વર્ષના(૨૦૨૦–૨૧)ની પરિસ્થિતિને ધ્યાને લેતા સને ૨૦૨૦– २९ तेमक्र सने २०२९-२२ ना वर्ष पुरती जाडी रहम मारे तमाम प्रडारनी मिलडतोमां नोटीस ही, वोरंट ही नी रडममां ૧૦૦% રકમ ઇન્સેન્ટીવ રિબેટ તર્રીકે આપવામાં આવશે.
- (૨) તમામ પ્રકારની મિલકતોમાં ચાલું વર્ષના (૨૦૨૧–૨૨) તથા પાછલા વર્ષના (૨૦૨૦–૨૧)ની વર્ષ પુરતી બાકી સ્ક્રમ ઉપર ચઢેલ ત્યાજમાં રહેણાંક મિલકતોમાં ૧૦૦% તથા બિનરહેણાંકમાં ૭૫% ઇન્સેન્ટીવ રિબેટ તર્રીકે આપવામાં આવ્શે.
- 3) અને ૨૦૨૦–૨૧ સુધીના મિલકત વેચાના બીલમાં જે ફ્રક્ત વ્યાજની રકમ બાકી હશે તો તેવા કરદાતાને પણ સદર યોજનાનો લાભ
- ૪) જે અરજદાર ક્ષેત્રફળ આધારિત આકારણીની સને ૨૦૦૩-૦૪ થી ૨૦૨૧-૨૨ સુધીના મિલકત વેરા પૂર્ણ પણે ભરપાઇ કરશે तेओने सहर छन्सेन्टीव रीजेट योषनानो वाल मणशे.
- ૫) કોઇપણ કરદાતા ભાડા આકારણી પધ્ધતિની રકમ બાડી હોય અને ફક્ત ક્ષેત્રફળ આધારિત પદ્ધતિ મુજબના સને ૨૦૨૧–૨૨ સુધીના મિલકત વેરાની રકમ ભરપાઇ કરે તો તેને પણ સદર યોજનાનો લાભ આપવામાં આવશે.

ઉપરોક્ત સંપૂર્ણ યોજનાનો લાભ ફક્ત યોજનાના અમલ તા.સ૧/૦૨/૨૦૨૨ થી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન વેરો ભરનાર કરદાતાઓને જ મળવાપાત્ર રહેશે.

સદસ યોજના અંતર્ગત ચેકથી ભરવામાં આવેલી રકમનો ચેક કોઇપણ કરણોસર રીટર્ન થશે અને યોજનાની મુદ્દત પુરી થયેલી હશે તેવા કિસ્સામાં કરદાતાએ વ્યાજ સિંદતની પુરેપુરી રકમ ભરવાની રહેશે.

સદર બાબતે વધુ માહિતીની જરૂર જણાય તો સંબધિત વોર્ડ કચેરીનો કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવા વિનંતી છે.

પી.આર.ઓ.નં. ૧૦૩૩/૨૦૨૧-૨૨

મ્યુનિસિપલ કમિશનર



મુખ્ય મટીરીયલ્સ મેનેજર માટે

૨૭.૦૦ સેટ ૧૪-માર્ચ-૨૨

૩૪૦૦.૦૦ નંગ ૧૮-માર્ચ-૨૨

૨૦૫.૦૦ કેએમ ૨૮-માર્ચ-૨૨

|૨૪૦.૦૦ નંગ |૨૮-માર્ચ-૨૨

સીઆઈએન: એલદપ૧૯૦૧૧૧૧૯૪પીએલસી૦૨૧૦૧૨

રજીસ્ટર્ડ ઓફિસઃ આઈસીઆઈસીઆઈ બેંક ટાવર, ચક્લી સર્કલની પાસે, જુના પાદસ રોડ, વડોદરા-૩૯૦ ૦૦૭, ગુજરાત, ફોનઃ ૦૨૬૫-૬૭૨૨૮૬ કોર્પોર્વેટ ઓફિસઃ આઈસીઆઈસીઆઈ બેંક ટાવર્સ, બાંદ્રા-કુર્લા ક્રેમ્પ્લેક્સ, મુંબઈ-૪૦૦ ૦૫૧, મહારાષ્ટ્ર, **ફોન**ઃ ૦૨૨-૨૬૫૩૮૯૦૦, ફેક્સઃ ૦૨૨-૨૬૫૩૧૨૩૦ वेजसार्धः www.icicibank.com, र्रभेर्धः investor@icicibank.com

પોસ્ટલ બેલેટ અંગે નોટીસ

આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ ("બેંક"/"કંપની") ના સભ્યોને આથી જાણ કરવામાં આવે છે કે કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૧૦ ની જોગવાઈઓ ય લાગુ જોગવાઈઓ, જો ક્રેઈ હોય તો, તેના માટે ક્રેઈપણ વૈધાનિક ફેરફાર અથવા પુન:અધિનિયમ સહિત અત્યારે અમલમાં છે ("અધિનિયમ કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમો ૨૦ અને ૨૨ સાથે વાંચતા, જેમાં કોઈપણ વૈધાનિક ફેરફાર અથવા પુન:અધિનિયમ સહિત અત્યારે અમલમાં છે ("નિયમો"), સાથે વાંચતા એપ્રિલ ૮, ૨૦૨૦ના રોજનો સામાન્ય પરિપત્ર નં.૧૪/૨૦૨૦, એપ્રિલ ૧૩, ૨૦૨૦નો સામાન્ય પરિપત્ર નં.૧૭/૨૦૨૦ અને અન્ય સંબંધિત પરિપત્રો, જેમાં ડિસેમ્બર ૮, ૨૦૨૧ના રોજના સામાન્ય પરિપત્ર નં.૨૦/૨૦૨૧નો સમાવેશ થાય છે, જે કોર્પોરેટ બાબતોના મંત્રાલય, ભારત સરકાર ("એમસીએ પરિપત્રો") દ્વારા જારી કરવામાં આવ્યા છે, તેમાં સભ્યો દ્વારા માત્ર રીમોટ ઈ-વોટિંગ પ્રક્રિયાથી પોસ્ટલ બેલેટ દ્વારા

- ૧. સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે સુશ્રી વિભા પૌલ ઋષિની (ડીઆઈએન: ૦૫૧૮૦૭૯૬) નિયુક્તિ માટે ખાસ ઠરાવ.
- ૨. ચાલુ ખાતા થાપણો માટે મટિરિયલ રીલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ માટે સામાન્ય ઠરાવ.
- રીલેટેડ પાર્ટીઓ પાસેથી સિક્યુરિટીઝની ખરીદી અને રીલેટેડ પાર્ટીઓ દ્વારા ઈસ્યુ કરાયેલ સિક્યુરિટીઝ સબસ્કાઈબ કરવા મટિરિયિલ રીલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ માટે સામાન્ય ઠરાવ.
- ૪. રીલેટેડ પાર્ટીઓને સિક્યરિટીઝના વેચાણ માટે મટિરિયલ રીલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ માટે સામાન્ય ઠરાવ.
- ૫. નોન-ફંડ આધારિત કે ફંડ આધારિત ક્રેડિટ સુવિધાઓ માટે મટિરિયલ રીલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ માટે સામાન્ય ઠરાવ.
- દ. અન્ય અનુમતિ પ્રાપ્ત ટૂંકાગાળાનું બોરોઈંગ ટ્રાન્ઝેક્શન્સ અને અંડરટેકિંગ રિપરચેઝ (રેપો) ટ્રાન્ઝેક્શન્સના મટિરિયલ રીલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ માટે
- ૭. અન્ય અનુમતિ પ્રાપ્ત ટૂંકાગાળાના લેન્ડિંગ ટ્રાન્ઝેક્શન્સ અને રિવર્સ રિપરચેઝ (રિવર્સ રેપો)ના મટિરિયલ રીલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ માટે સામાન્ય ઠરાવ. ૮. રીલેટેડ પાર્ટી તરફથી બેંકના અમુક કાર્યો/પ્રવૃતિઓ માટે માનવશ્રમ સેવાઓ પ્રાપ્ત કરવા મરિરિયલ રીલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ માટે સામાન્ય ઠરાવ.
- સભ્યોને જાણ કરવામાં આવે છે કે બેંક દ્વારા ફેબ્રુઆરી ૨૪, ૨૦૨૨ના રોજ ફેબ્રુઆરી ૧૮, ૨૦૨૨ની તારીખ ધરાવેલ પોસ્ટલ બેલેટ નોટિસ બેંકના સભ્યોને કે

જેઓના નામ રજિસ્ટર ઓફ મેમ્બર્સ / ડિપોઝિટરીઝ જેમકે નેશનલ સિક્ચોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ ("એનએસડીએલ") અને સેન્ટ્રલ ડિપોઝિટરી સવિસિસ (ઇન્ડિયા) લિમિટેડ ("સીડીએસએલ")ના લિસ્ટ ઓફ બેનિફિશિયલ ઓઉનર્સમાં શુક્રવાર, ફેબ્રુઆરી ૧૮, ૨૦૨૨ના નોંધાયેલા છે તથા જેમણે તેમના ઈમેઈલ એડ્રેસીસ બેંક / ડિપોઝીટરીઝ પાસે રજિસ્ટર્ડ કરાવેલ છે તેમને રિમોટ ઈ-વોટિંગથી પોસ્ટલ બેલેટ દ્વારા મંજૂરી માંગવા માટે ઈલેક્ટ્રોનિક રીતે મોક્લવામાં આવી છે. જે વ્યક્તિ શુક્રવાર, ફેબ્રુઆરી ૧૮, ૨૦૨૨ મુજબ સભ્ય નથી, તે વ્યક્તિ માટે પોસ્ટલ બેલેટ નોટિસ માત્ર માહિતીના હેતુ માટે જ છે.

પોસ્ટલ બેલેટ નોટિસ બેંકની વેબસાઈટ https://www.icicibank.com/aboutus/notice.page?#toptitle, સ્ટોક એક્સચેન્જિસની વેબસાઈટ્સ www.bseindia.com અને www.nseindia.com તેમજ એન એસ.ડી.એલની. વેબસાઈટ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ છે.

ડીમટીરિયલાઈઝ્ડ સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યોને સંબંધિત ડિપોઝિટરી સહભાગીઓ સાથે ઈમેલ એડ્રેસ સહિત તેમની કેવાયસી વિગતો નોંધણી/અપડેટ કરવા વિનંતી કરવામાં આવે છે. ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવનાર સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ શેર પ્રમાણપત્રની નક્લ (આગળ અને પાછળ),પાન કાર્ડની પ્રમાશિત નકલ અને Form ISR-1માં દર્શાવેલ આવા અન્ય દસ્તાવેજો સાથે યોગ્ય રીતે ભરેલું અને સહી કરેલું ફોર્મ investor@icicibank.com પર સબમિટ કરીને ઈમેઇલ એડ્રેસ સહિત તેમની કેવાયસી વિગતો નોંધણી/અપડેટ કરવી. Form ISR-1 બેંકની વેબસાઈટ https://www.icicibank.com /aboutus/invest-relations.page?ITM=nli_cms_investor_relations_footer_link પર ઉપલબ્ધ છે.

બેંકના સભ્યો કે જેમના નામ રજીસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝિટરીઝ એટલે કે, એનએસડીએસ/સીડીએસએલમાંથી મળેલ લિસ્ટ ઓફ બેનિફિશિયલ ઓઉનર્સમાં શુક્રવાર, ફેબ્રુઆરી ૧૮, ૨૦૨૨ના રોજ દર્શાવેલ છે, તે સભ્યો પોસ્ટલ બેલેટમાં ઉલ્લેખિત ઠરાવોના સંબંધમાં મત આપવા માટે હકદાર રહેશે. સભાસદો ઈલેક્ટ્રોનિક રીતે તેમનો મત આપી શકે તે માટે બેંકે રિમોટ ઈ-વોટિગંની સુવિધા માટે એનએસડીએલની નિમણુંક કરી છે. ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવતા અથવા જેમણે પોતાનું ઈમેલ એડ્રેસીસ રજીસ્ટર કરાવ્યા નથી તે સહિતના સભ્યો, ફેબ્રુઆરી ૧૮, ૨૦૨૨ ના રોજ પોસ્ટલ બેલેટ નોટિસમાં દર્શાવેલ સૂચનાઓને અનુસરીને તેમના મત આપી શકે છે.

રિમોટ ઈ-વોટિંગનો સમયગાળો શનિવાર, ફેબ્રુઆરી ૨૬, ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે (ભારતીય સ્ટાન્ડર્ડ સમય) થી શરૂ થાય છે અને રવિવાર, માર્ચ ૨૭, ૨૦૨૨ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે (ભારતીય સ્ટાન્ડર્ડ સમય) સમાપ્ત થાય છે. રીમોટ ઈ-વોટીંગને ઉક્ત તારીખ અને સમય પછી મંજૂરી આપવામાં આવશે નર્કી. રિમોટ ઈ-વોટિંગ મોડ્યુલ ત્યારબાદ મત આપવા માટે નિશ્કીય કરી દેવામાં આવશે. એક્વાર સભ્ય દ્વારા ઠરાવ પર મત આપવામાં આવશે, પછી સભ્યને તેમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

સભ્યોના મતદાનના અધિકારો શુક્રવાર, ફેબ્રુઆરી ૧૮, ૨૦૨૨ના રોજ, બેંકિંગે રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની સુધારેલ જોગવાઈઓને આધીન બેંકના કુલ પેઈડ-અપ ઈક્વિટી શેર કેપિટલ પર તેમની પાસે રહેલા શેરના પ્રમાણમાં રહેશે.

આપ ઈ-વાટિંગ સંબંધિત કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ અથવા ફરિયાદોના કિસ્સામાં, કૃપા કરીને *www.evoting.nsdl.com* પર ઉપલબ્ધ Help/FAQ'sના વિભાગનો સંદર્ભ લઈ શક્રે છો અથવા ટોલ ફ્રી નં. ૧૮૦૦-૧૦૨૦*-૯૯૦*/૧૮૦૦-૨૨૪-૪૩૦ પર ક્રેલ કરી શક્રે છો અથવા *evoting@nsdl.co.in* પર અનુરોધ મોક્લી શક્રે છો અથવા સુશ્રી પલ્લવી મહાત્રે, મેનેજર, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, ટ્રેડ વર્લ્ડ, 'એ' વિંગ, ૪થો માળ, કમલા મિલ્સ કમ્પાઉન્ડ, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ ૪૦૦ ૦૧૩ ને *pallavid@nsdl.co.in* પર સંપર્ક કરી શકો છો અથવા ટેલીશેન નં. +૯૧-૨૨-૨૪૯૯ ૪૫૪૫ પર કોલ કરી શકો છો. અન્ય વિકલ્પમાં સભ્યો બેંકના કંપની સેક્રેટરીને investor@icicibank.com પર લખીને અથવા ટેલીફોન નં. +૯૧-૨૨-૨૬૫૩ ૮૯૦૦ પર કોલ કરીને સંપર્ક કરી શકે છે.

પોસ્ટલ બેલેટનું પરિણામ માર્ચ ૨૯, ૨૦૨૨ મંગળવારના રોજ કે તે અગાઉ સાંજે ૬:૦૦ વાગ્યા (ભારતીય સ્ટાન્ડર્ડ સમય) પહેલા કોઈપણ સમયે જાહેર કરાશે અને સ્ક્રુટિનાઈઝર્સનો રિપોર્ટ સાથે બેંકની રજિસ્ટર્ડ તેમજ કોર્પોરેટ ઓફિસ પર ઉપલબ્ધ થશે, જેની જાણ સ્ટોક એક્સચેન્જિસને કરાશે અને તે બેંકની વેબસાઈટ www.icicibank.com અને એનએસડીએલની વેબસાઈટ www.evoting.nsdl.com પર પણ અપલોડ કરાશે.

> બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આદેશથી અને વતી સહી/-

રંગનાથ અથ્રેયા તારીખ: ફેબ્રુઆરી ૨૫, ૨૦૨૨ કંપની સેક્રેટરી



CIN-L65190GJ1994PLC021012

Registered Office: ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodara 390,007, Guiarat, Phone: 0265-6722286 Corporate Office: ICICI Bank Towers, Bandra-Kurla Complex, Mumbai 400 051, Maharashtra, Phone: 022-26538900, Fax: 022-26531230 Website: www.icicibank.com. Email: investor@icicibank.com

NOTICE OF POSTAL BALLOT

Members of the ICICI Bank Limited ("Bank"/"Company") are hereby informed that pursuant to the provisions of Section 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 including any statutory modification or re-enactment thereof for the time being in force ("Act"), read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 including any statutory modification or re-enactment thereof for the time being in force ("Rules"), read with General Circular No.14/2020 dated April 8, 2020, General Circular No.17/2020 dated April 13, 2020 and other relevant circulars, including General Circular No.20/2021 dated December 8, 2021, issued by the Ministry of Corporate Affairs, Government of India ("MCA Circulars"), the following resolutions are proposed to be passed by the Members through Postal Ballot only through the remote e-voting

- 1. Special Resolution for Appointment of Ms. Vibha Paul Rishi (DIN: 05180796) as an Independent Director.
- 2. Ordinary Resolution for Material Related Party Transactions for current account deposits.
- 3. Ordinary Resolution for Material Related Party Transactions for subscribing to securities issued by Related Parties and
- purchase of securities from Related Parties. 4. Ordinary Resolution for Material Related Party Transactions for sale of securities to Related Parties.
- 5. Ordinary Resolution for Material Related Party Transactions for fund based or non-fund based credit facilities.
- 6. Ordinary Resolution for Material Related Party Transactions for undertaking repurchase (repo) transactions and other permitted short-term borrowing transactions. 7. Ordinary Resolution for Material Related Party Transactions of reverse repurchase (reverse repo) and other permitted short-
- term lending transactions. 8. Ordinary Resolution for Material Related Party Transactions for availing manpower services for certain functions/activities of

Members are informed that the Bank has on February 24, 2022, sent the Postal Ballot Notice dated February 18, 2022 through electronic mode to the Members of the Bank whose names appear in the Register of Members/List of Beneficial Owners as received from Depositories i.e. National Securities Depository Limited ("NSDL") and Central Depository Services (India) Limited ("CDSL") as on Friday, February 18, 2022 and who have their e-mail addresses registered with the Bank/Depositories, for seeking approval by Postal Ballot only through remote e-voting. A person who is not a Member as on Friday, February 18, 2022, should treat the Postal Ballot Notice for information purposes only.

The Postal Ballot Notice is also available on the website of the Bank at https://www.icicibank.com/aboutus/notice.page?#toptitle, website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and the website of NSDL at www.evoting.nsdl.com. Members holding shares in dematerialised mode are requested to register/update their KYC details including email address with $the {\it relevant Depository Participants}. Members {\it holding shares in physical mode} {\it are requested to register/update their KYC details}$ including email address by submitting duly filled and signed Form ISR-1 at investor@icicibank.com along with the copy of the share certificate (front and back), self-attested copy of the PAN card and such other documents as prescribed in the Form. Form ISR-1 is available on the website of the Bank at https://www.icicibank.com/aboutus/invest-relations.page?ITM=nli_cms_ investor_relations_footer_link.

Members of the Bank whose names appear in the Register of Members/List of Beneficial Owners as received from Depositories i.e., and the second of the Bank whose names appear in the Register of Members/List of Beneficial Owners as received from Depositories i.e., and the second of the Bank whose names appear in the Register of Members/List of Beneficial Owners as received from Depositories i.e., and the Register of Members are the Register of Members and the Register of Members and Register of Members anNSDL/CDSL as on Friday, February 18, 2022, shall be entitled to vote in relation to the resolutions specified in the Postal Ballot Notice. The Bank has appointed NSDL for facilitating remote e-voting to enable the Members to cast their votes electronically. Members including those who are holding shares in physical form or who have not registered their email addresses, can cast their votes by following the instructions mentioned in the Postal Ballot Notice dated February 18, 2022.

The remote e-voting period commences on Saturday, February 26, 2022 at 9:00 a.m. IST and ends on Sunday, March 27, 2022 at 5:00 p.m. IST. The remote e-voting shall not be allowed beyond the said date and time. The remote e-voting module shall be disabled for voting thereafter. Once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it

The voting rights of the Members shall be in proportion to their shares in the total paid-up equity share capital of the Bank, as on $Friday, February\,18, 2022, subject\,to\,the\,provisions\,of\,the\,Banking\,Regulation\,Act, 1949, as\,amended.$

In case of any queries or issues or grievances pertaining to e-voting, Members may refer to Help/FAQ's section available at www.evoting.nsdl.com or call on toll free no.: 1800-1020-990/1800-224-430 or send a request at evoting@nsdl.co.in or contact Ms. Pallavi Mhatre, Manager, National Securities Depository Limited, Trade World, 'A' Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai 400 013, at pallavid@nsdl.co.in or at telephone no.: +91-22-2499 4545. Alternatively, Members may also write to the Company Secretary of the Bank at investor@icicibank.com or contact at telephone no.: +91-22-

The results of Postal Ballot shall be declared on or before Tuesday, March 29, 2022, at any time before 6:00 p.m. IST and along with the Scrutinizer's report, be displayed at the Registered as well as Corporate Office of the Bank, communicated to the Stock Exchanges and will also be uploaded on the Bank's website at www.icicibank.com and on the website of NSDL at www.evoting.nsdl.com.

For and on behalf of the Board of Directors

Ranganath Athreya **Company Secretary**

Place : Mumbai Date: February 25, 2022